

સાર (પ્રમુખપાર્ક સોસા., વાઘોડિયા રોડ), મ સોસા., આજવા રોડ), નીલેશ અરવિંદ (રાવાડી), શ્રેતાંગ જગદીશ પટેલ (રંગીલા), સુનીલ અરવિંદ મિસ્ત્રી (હુનુમાન પોળ, વાનદાસ પટેલ (ઓમ રેસિ., વાઘોડિયા હ (પરેશનગર, ગાજરાવાડી), જશુ કેશુર ને રૂ.૧.૨૦ લાખ, ૯ મોબાઈલ, ૮ લાખની મુદ્દામાલ કબજે કર્યો હતો

અને સુધારો અને બાળકોને યોગ્ય ધાન પોષાહાર આપવામાં તેમની મુક સાથે મળી કામ કરે. વડાપ્રધાન નિધિ ખાને ધનિકો અને ગરીબોની યાત્રા જીવનશૈલીમાં વધતી ખાઈને સૈન્ય પુણ રેખાંકિત કરી. તેમણે કહ્યું કે તેઓ શાસનની મિતવ્યયી શૈલીને અપનાવશે, ખાને કહ્યું કે તેઓ વડાપ્રધાન આવાસમાં નહીં પરંતુ સૈન્ય સચિવના ત્રણ બેડરૂમવાળા ઘરમાં રહેશે. તેમણે કહ્યું કે તેઓ બાનીગાલામાં પોતાના ઘરમાં રહેવા માંગતા હતા પરંતુ સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે તેમના જીવને ખતો આથી તેઓ અહીં રહે છે.

સમગ્ર વિસ્તારમાં ભાગદોડના દૈનિક સર્જાયાં હતાં. આ સમયે પોલીસ તંત્રના સંયુક્ત કાર્યવાહી કાર્યવાહીઓ ૧૨ ગાયોને બચાવવામાં સફળ થયા હતા. એમ.ઈ.ટી. સ્કૂલની સામે આવેલા વિસ્તારમાં પોલીસ તંત્રના કાર્યવાહી અને હુમલાખોરો વચ્ચે સર્જાયેલ આ અથડામણમાં પોલીસ તંત્રે ૧૦ જેટલા ટિયરગેસના સેલ છોડતાં આ સ્કૂલમાં હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિત્તિ બની દોડધામ કરતા નજરે દેખાતા હતા. સાતપુલઓઢાના સંવેદનશીલ અંતરિયાળ વિસ્તારમાં ગાયોને બચાવવા જતાં પોલીસ તંત્રે હુમલાખોરોથી બચવા ૧૦ જેટલા ટિયરગેસના સેલ છોડ્યા હોવાની જાણકારી સાથે પોલીસ અધિક્ષક બીના પાટીલ શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને કસાઈઓ પ્રેરિત આ હુમલાખોરો સામે કાયદેસર કાર્યવાહીની સૂચનાઓ આપી હતી.

સાજિદ રાબડીનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે, જે આવતીકાલે પોલીસ સર્ગાસંબંધીઓને લેખિતમાં જાણ કર્યા બાદ એ લોકો મૃતદેહ લેવા આવે છે કે નહીં એ જોવું રહ્યું.

નશીલા...
બહેન નશાના બંધાણીઓને વેચાણ કરતા હોવાની આરોપીઓએ ચોકાવનારી કબૂલાત કરી હતી. ૬૪ હજારની કિંમતનો મનાતો ગાંજનો ૯ કિલોનો જથ્થો કબજે કરીને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિકનો ગુનો વાઘોડિયા પોલીસ મથકે દાખલ કર્યો હતો. વાઘોડિયા પોલીસે બંને આરોપીઓનો કબજો મેળવીને આગળની તપાસ હાથ ધરી હતી.

આવેદનપત્ર..
રહી છે. જેના ભાગરૂપે આંદોલન સાથે જોડાયેલા ધારાસભ્યો અને અન્ય આગેવાનો આજે શહેરમાં આવ્યા હતા. આજે સવારે બિરસા આંબેડકર સ્વાધિકાર આંદોલન સાથે

ઉપ તરુણકુમ વંદનાબે બી-

દુ

The 7 at S. asse Elect 201 Part Rep othe com Noti Obli Boo incl pur In c Cor the 20 pr the au fol Pu ini a) b) e) d) e) f)

પૂબ બાજુ ડેક્સ

તાને પૂલન, ધામાં

વેદા જી

3

બેટરી.

JHAVERI CREDITS AND CAPITAL LIMITED
CIN: L65910GJ1993PLC020371
Reg. Office: 301, Payal Towers-II, Sayajigunj, Vadodara-390020
Website: www.jhavericommodity.com, E-mail: igc@jhaveritrade.com, Contact No.: 0265-2226201

NOTICE

NOTICE is hereby given that the 24th Annual General Meeting of the Shareholders of the Company Jhaveri Credits & Capital limited will be held on Saturday, 15th September, 2018 at 11:00 a.m. at the registered office of the Company to transact the ordinary business, as set out in the notice of Annual General Meeting. As permitted under Rule 11 of the Companies (Accounts) Rules, 2014, the Annual Report of the Company for financial year 2017-18 have been sent through electronic mode to those shareholders who have registered their e-mail id with depositories and the physical copies were dispatched to other shareholders at their registered postal address by permitted mode. Pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Company is offering e-voting facility for transaction business through e-voting services provided by National Securities Depository Limited (NSDL). The Company is also offering the facility of Postal Ballot to the Members to cast their vote and also physical ballot at the AGM. In accordance with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015, the Company has fixed 07th September, 2018 as 'cut-off date' to determine the eligibility to vote by electronic means or in Annual General Meeting. A person whose name is recorded in the register of members or in the register of beneficial owner maintain by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting or voting in the Annual General Meeting. The remote e-voting period begins on 9:00 am Wednesday 12th September, 2018 and ends on Friday 14th September, 2018 at 5:00 p.m. During this period the eligible shareholder of the company holding shares either in physical form or in dematerialized form, may cast their vote electronically. The e-voting module shall be disabled by NSDL for voting thereafter. The facility for voting, through ballot/polling paper shall also be made available at the venue of the AGM. The members who have already cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again at the AGM. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. 07th September, 2018 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or Issuer/RTA. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot User Details/Password" option available on www.evoting.nsdl.com or contact NSDL at the following toll free no.: 1800-222-990 NOTICE is also given under Section 91 of the Companies Act, 2013 that the Registered of Members and Transfer Books of the Company will remain closed form 07th September, 2018 to 14th September, 2018 (both days inclusive) for the purpose of the Annual General Meeting.

for and on behalf of Board of Directors
of M/s Jhaveri Credits & Capital Ltd
Kamlesh J. Jhaveri, Whole Time Director
DIN: 00266242

Date: 14.08.2018
Place: Vadodara




own judgement. Business Standard does not associate itself with or stand by the contents of any of the advertisements accepted in good faith and published by it. Any claim related to the advertisements should be directed to the advertisers concerned. Unless explicitly stated otherwise, all rights reserved by M/s Business Standard Pvt. Ltd. Any printing, publication, reproduction, transmission or redissemination of contents, in any form or by any means, is prohibited without the prior written consent of M/s Business Standard Pvt. Ltd. Any such prohibited and unauthorised act by any person/legal entity shall invite civil and criminal liabilities.

No Air Surcharge

Business Standard
Insight Out

To book your copy, call **022 24978470** or SMS **reachbs** to **56677** or email us at **order@bsmail.in**
www.business-standard.com



JHAVERI CREDITS AND CAPITAL LIMITED
CIN: L65910GJ1993PLC020371

Reg. Office: 301, Payal Towers-II, Sayajigunj, Vadodara-390020
Website: www.jhavericommodity.com, E-mail: igc@jhaveritrade.com, Contact No.: 0265-2226201

NOTICE

NOTICE is hereby given that the 24th Annual General Meeting of the Shareholders of the Company Jhaveri Credits & Capital limited will be held on Saturday, 15th September, 2018 at 11:00 a.m. at the registered office of the Company to transact the ordinary business, as set out in the notice of Annual General Meeting. As permitted under Rule 11 of the Companies (Accounts) Rules, 2014, the Annual Report of the Company for financial year 2017-18 have been sent through electronic mode to those shareholders who have registered their e-mail id with depositories and the physical copies were dispatched to other shareholders at their registered postal address by permitted mode. Pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015, the Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Company is offering e-voting facility for transaction business through e-voting services provided by National Securities Depository Limited (NSDL). The Company is also offering the facility of Postal Ballot to the Members to cast their vote and also physical ballot at the AGM. In accordance with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015, the Company has fixed the 'cut-off date' to determine the eligibility to vote by electronic means or in dematerialized form, may cast their vote electronically. The e-voting module shall be disabled by NSDL on 9:00 am Wednesday 12th September, 2018 and ends on Friday 14th September, 2018 at 5:00 p.m. During this period the eligible shareholder of the company holding shares either in physical form or in dematerialized form, may cast their vote electronically. The e-voting module shall be disabled by NSDL for voting thereafter. The members who have already cast their vote by remote e-voting prior to the venue of the AGM. The members who have already cast their vote again at the AGM. Any meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again at the AGM. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. 07th September, 2018 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or Issuer/RTA. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot User Details/Password" option available on www.evoting.nsdl.com or contact NSDL at the following toll free no.: 1800-222-990 NOTICE is also given under Section 91 of the Companies Act, 2013 that the Registered of Members and Transfer Books of the Company will remain closed from 07th September, 2018 to 14th September, 2018 (both days inclusive) for the purpose of the Annual General Meeting.

for and on behalf of Board of Directors
of M/s Jhaveri Credits & Capital Ltd
Kamlesh J. Jhaveri, Whole Time Director
DIN: 00266242

Date: 14.08.2018
Place: Vadodara

NOTICE

3 Years	7.45%
5 Years	
FOR RATE	
Link Intime India Pvt Ltd. C-10	
All communi	
Contact Numbers:	

PARTICULARS AS REQUIRED I

- a) Name of the Company
- b) Date of Incorporation
- c) Business carried on by the Company and its subsidiaries with details of office
 - i) Registered Office
 - ii) Corporate Office
 - iii) Subsidiary Companies

iv) The Company has Regional Offices : Eastern Region- (0522) 2394358, 2396949
Western Region- (022) 22693675, 22693676
Back Office : Ahmedabad (079) 2611114
Chennai (044) 24351079, 2431114
22128628, Lucknow (0522) 4154
Raipur (0771) 2583819, Vijayawada

In addition to above the Company has Brief Particulars of the management and The Address is managed by the M Name, address and occupation of

Sr. No.	Name
1	Shri. V. K. Sharma, Chairman
2	Smt. Usha Sangwan, Director
3	Shri. Vinay Sah, Managing Director
4	Shri. Jagdish Capoor, Director
5	Smt. Savita Singh, Director
6	Shri. Dharmendra Bhanu, Director
7	Shri. Debabrata Sarkar, Director
8	Shri. V. K. Kukreja, Director
9	Shri. Ameet Patel, Director
10	Shri. Koteswar Rao, Director

f) & g) Profit and Dividend
Financial Y
31st Marc
31st Marc
31st Marc
h) Summarised financial pos